

# ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૦૭ ઓક્ટોબર ૨૦૨૩, શનિવાર વિક્રમ સંવત ૨૦૭૯, ભાદરવો વદ આઠમ વર્ષ : ૧૫ અંક : ૭૨ તંત્રી : પટેલ સુરેશ રમણલાલ અમદાવાદ કિંમત : રૂ. ૨.૦૦ પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

## ફાયર વિભાગની ૧૦ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો મુંબઈમાં સાત માળની ઇમારતમાં ભીષણ આગ, સાત લોકોના મોત પાર્કિંગમાં પાર્ક કરેલી ૪ કાર અને ૩૦થી વધુ બાઈક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું

મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. MG રોડ પરની સાત માળની ભવાની બિલ્ડિંગમાં આગ લાગતાં સાત લોકોના મોત થયા છે. આગમાં અત્યાર સુધીમાં ૩૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. દસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ગઈકાલે રાત્રે લગભગ ૩ વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી. લગભગ દસથી બાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ૩૧ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા જ્યારે ૩૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.



આ આગ મુંબઈના ગોરેગાંવમાં G5 બિલ્ડિંગમાં લાગી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આગમાંથી ૩૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ૧૦ ગાડીઓએ ગોરેગાંવ વેસ્ટમાં જય ભવાની નામની ઇમારતમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી.

તાત્કાલિક પોતાના વાહનોને સ્થળ પર મોકલ્યા હતા. અહીં બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી ૪ કાર અને ૩૦થી વધુ બાઈક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હોઈ શકે છે. આગ થોડી જ વારમાં આખા પાર્કિંગ અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. HBT હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઘાયલોમાંથી ૬ લોકોના મોત થયા છે, જેમાં પાંચ મહિલાઓ (૨ બાળકો) અને એક પુરુષનો સમાવેશ થાય છે. ૨૫ ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં ૧૨ પુરુષો અને ૧૩ મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોને કૂપર હોસ્પિટલ અને HBT હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

## ઈરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવાના સંઘર્ષ બદલ સન્માન મળ્યું વર્ષ ૨૦૨૩નો નોબલ શાંતિ પુરસ્કાર ઈરાનના એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને

નરગીસ ૧૯૯૦ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે, ૨૦૦૩માં તેહરાનમાં ડિક્ટેન્ડર્સ ઓફ હુમન રાઈટ્સ સેન્ટરમાં કામ શરૂ કર્યું. વોશિંગ્ટન, ટા.ક. નોબલ પુરસ્કાર-૨૦૨૩ હેઠળ શાંતિ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે ઈરાનની એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોહમ્મદીને આ પુરસ્કાર ઈરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના તેમના સંઘર્ષ બદલ તેને એનાયત કરવામાં આવ્યો છે. મોહમ્મદીએ ઈરાનમાં લોકો માટે માનવ અધિકાર અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે લાંબા સમયથી લડત ચલાવી છે. ઈરાનના કુર્દિસ્તાનના ઝાંજાન શહેરમાં તેમનો જન્મ થયો હતો. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. તેઓ એક કટારલેબક પણ છે. ઘણા અખબારો માટે તેમણે લેખ લખ્યા છે. નરગીસ ૧૯૯૦ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે. ૨૦૦૩માં તેમણે તેહરાનમાં ડિક્ટેન્ડર્સ ઓફ હુમન રાઈટ્સ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જેમણે અધિકારોની વાત કરી અને એક-બાર નહીં પરંતુ ૧૩ વખત ઘરપકડ કરવામાં આવી હતી. નોર્વેજીયન નોબલ સમિતિના અધ્યક્ષે આજે ઓસ્લોમાં પુરસ્કારની જાહેરાત કરી હતી. તેમણે એવોર્ડ એનાયત કરતી વખતે કહ્યું કે, સૌ પ્રથમ આ એવોર્ડ ઈરાનમાં



સમગ્ર ચળવળ અને તેના નિર્વિવાદ નેતા નરગીસ મોહમ્મદીના પૂર્વ જ મહત્વપૂર્ણ કાર્યને માન્યતા આપવા માટે છે. નોબલ પુરસ્કાર વિજેતા નરગીસ હજુ પણ ઈરાનની જેલમાં બંધ છે. તેને ૩૧ વર્ષની જેલ અને ૧૫૪ કોરડા ફટકારવામાં આવ્યા હતા. તેના પર ઈરાન સરકાર વિરુદ્ધ દુષ્ક્રિયાર ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. નોબેલ મળ્યા બાદ નરગીસને ૮.૩૩ કરોડ રૂપિયાનું ઈનામ અને ગોલ્ડ મેડલ મળશે.

## ન્યૂઝ ફ્રન્ટ સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે

નવી દિલ્હી, ટા.ક. સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે. કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે સરકારી વિભાગોમાં ૪૫ દિવસ કે તેનાથી વધુની અસ્થાયી નિમણૂકમાં એસસી/ એસટી/ ઓબીસીઅનામત મળશે. કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતને કડક રીતે લાગુ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ખરેખર તો કરાર આધારિત નોકરીઓમાં એસસી/ એસટી/ ઓબીસીઅનામતની માગ સંબંધિત એક અરજી દાખલ કરાઈ હતી. તેના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે ૨૦૨૨ માં જ ભારત સરકાર દ્વારા જાહેર કરેલી નોટિફિકેશનમાં આ અંગે માહિતી આપાઈ હતી. સરકાર દ્વારા જણાવવાનું હતું કે કેન્દ્ર સરકારના પદો અને સેવાઓમાં નિમણૂકના સંબંધમાં ૪૫ દિવસ કે તેનાથી વધુ દિવસની અસ્થાયી નિમણૂકમાં એસસી/ એસટી/ ઓબીસીઅને દવારોને અનામત મળશે.

## પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટની નજીક મોટો વિસ્ફોટ

કરાંચી, ટા.ક. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટમાં વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબના ડેરા ગાઝી ખાન જિલ્લામાં બની હતી. એવી વાત પણ સામે આવી રહી છે કે ૨૦૧૨થી તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (ટીટીપી) આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી ચૂક્યું છે. તો માનવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ પાછળ તેનો હાથ હોય શકે છે. પાકિસ્તાનમાં શનિવારે બલૂચિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા થયા હતા અને તેમાં ૬૫ લોકોના મોત થયા હતા. આત્મઘાતી હુમલાવરે પહેલા મસ્જુદ જિલ્લામાં એક મસ્જિદ

પાસે ઈદના જુલુસ નિમિત્તે ભેગા થયેલા લોકો વચ્ચે વિસ્ફોટ કર્યો હતો. અન્ય એક હુમલો ખેબર પશ્ચિમવાના હંડુ શહેરમાં એક મસ્જિદમાં થયો હતો. કુલ મળીને ૭૦ લોકો તેમાં મોતને ભેટ્યા હતા. હજી સુધી આ હુમલામાં કયા સંગઠનનો હાથ હતો તે શોધવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાને રાબંતા મુજબ ભારત પર આ વિસ્ફોટો બદલ દોષનો ટોપલો ઢોળી દીધો છે. પાકિસ્તાનના ગૃહ મંત્રીએ ભારતની જાસૂસી સંસ્થા રોને આ વિસ્ફોટો માટે જવાબદાર ઠેરવી છે. તેમણે ઠાવો કર્યો હતો કે, ભારતની જાસૂસી સંસ્થા રોનો વિસ્ફોટોમાં હાથ છે. પાકિસ્તાનની તમામ એજન્સીઓ આ વિસ્ફોટોમાં સામેલ તત્ત્વો સામે સંયુક્ત રીતે લડાઈ લડશે.

એનડીએ છોડવાની વાત જનસેના પાર્ટીના અધ્યક્ષે ફગાવી એનડીએમાં છું અને ટીડીપીને સમર્થન આપીશું: પવન કલ્યાણ

## સીરિયાના સંરક્ષણમંત્રીના રવાના થયાના થોડીવારમાં હુમલો સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુનાં મોત

હોમ્સ, ટા.ક. સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલાના અહેવાલ મળ્યાં છે. માહિતી અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં આવેલી સૈન્ય કોલેજમાં કરાયો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે અહીં ગ્રેજ્યુએશન સેરેમની ચાલી રહી હતી. ગુરુવારે થયેલા આ ડ્રોન હુમલામાં ૧૦૦ લોકોના મોતના અહેવાલ મળી



રહ્યા છે. આ ડ્રોન હુમલામાં ૬૩નેક લોકો ઘવાયા પણ હતા. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર સીરિયાના સંરક્ષણમંત્રીના ગ્રેજ્યુએશન સેરેમનીથી રવાના થયાની અમુક જ મિનીટો બાદ હથિયારધારી ડ્રોને આ જગ્યાએ બોમ્બમારો કરીદીધો હતો.

## એનડીએ છોડવાની વાત જનસેના પાર્ટીના અધ્યક્ષે ફગાવી એનડીએમાં છું અને ટીડીપીને સમર્થન આપીશું: પવન કલ્યાણ

અમરાવતી, ટા.ક. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે એનડીએ છોડવાની અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે જો તે ભવિષ્યમાં આવો કોઈ નિર્ણય લેશે તો તે અંગે યોગ્ય જાહેરાત કરશે. એવી અફવા ફેલાઈ હતી કે કલ્યાણ ટીડીપીને સમર્થન આપવા માટે

એનડીએમાંથી બહાર નીકળી ગયા છે. આ ઉપરાંત તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સામે પણ આકરા પ્રહારો કર્યા અને તેમને આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. પવન કલ્યાણે ગુરુવારે કૃષ્ણ વારાહી યાત્રાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે એનડીએમાંથી બહાર આવતા પહેલા હું મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને અન્ય વાય એસ આર સીપી નેતાઓને સલાહ આપવા માંગુ છું. તમારે પાર્ટીનું ધ્યાન રાખવું જોઈએ. તમે ચૂંટણી પર ધ્યાન આપો. તમે ૧૭૫ બેઠકો કેવી રીતે જીતી શકો છો તે નક્કી કરો અને જ્યાં સુધી મારા એનડીએમાંથી બહાર નીકળવાની વાત છે.

## મહારાષ્ટ્રમાં ૧૩૧ દર્દીના મોત માટે જવાબદાર કોણ : રાજ્યને પંચની નોટિસ

મુંબઈ, ટા.ક. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓનો મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. નાંદેડ બાદ હવે નાગપુરમાં માર ચાર જ દિવસમાં ૮૦ દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન આ બે જિલ્લામાં દર્દીઓના મોતનો આંકડો જોવામાં આવે તો કુલ ૧૩૧ લોકોના મોત થઈ ગયા છે. તેના માટે ખરેખર જવાબદાર કોણ છે? હોસ્પિટલ મેનેજમેન્ટ અને તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતાં હવે માનવાધિકાર પંચે મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી છે અને પૂછ્યું કે બે જિલ્લામાં ૧૩૧ લોકોના મોતનો જવાબદાર કોણ? તેના માટે ૪ અઠવાડિયાનો સમય આપ્યો છે.

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

LPGના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે?

સંતરામપુર જિલ્લા અને તાલુકાઓ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પત્રકારો નિમવાના છે સંપર્ક કરો

સંતોષકુમાર જોષી મો. 63550 761743

સમાચાર પત્ર છે લોકતંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ, જે કરે છે એક લોકતંત્રનો નિર્માણ !

CHANNEL NINE NETWORK GUJARAT

◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઈટ

આજે જ [cnngujarat.co.in](http://cnngujarat.co.in) વેબસાઈટ ઉપર વિઝીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...

CHANNL NINE NETWORK GUJARAT Gujarati Daily News Paper

LIVE [cnngujarat.co.in](http://cnngujarat.co.in)



એશિયન ગેમ્સમાં ભારત ૧૦૦ મેડલની નજીક

# જાપાનને ૫-૧થી હરાવીને ભારતને એશિયન ગેમ્સ હોકીમાં ગોલ્ડ મેડલ

આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત ૪-૨ થી જીત્યું હતું, ફાઈનલ મેચમાં ભારત તરફથી ખૂબ જ સારી રમત જોવા મળી હતી



હાંગઝોઉ, તા.૬ | ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સ ૨૦૨૩માં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ગત વખતના એશિયા ચેમ્પિયન જાપાનને ૫-૧થી હરાવ્યું છે. આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત ૪-૨ થી જીત્યું હતું. ફાઈનલ મેચમાં ભારત તરફથી ખૂબ જ સારી રમત જોવા મળી હતી. ભારતની સામે વિપ ક્ષી જાપાન માત્ર એક જ ગોલ કરવામાં સફળ રહ્યું હતું. આ ગોલ સાથે ભારતીય હોકી ટીમ ૨૦૨૩માં પેરિસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. મેચની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં મેચની ૨૫મી

મિનિટ ભારત તરફથી મેચનો પ્રથમ ગોલ થયો હતો. મનદીપ સિંહે આ ગોલ કરીને ભારતને ૧-૦ની લીડ અપાવી હતી. આ રીતે ભારતીય ટીમે મેચના હાફ ટાઈમમાં સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં મેચની ૩૨મી મિનિટ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે બીજો ગોલ કરીને ભારતને ૨-૦ની સરસાઈ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા અમિત રોહિલાસે ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ત્રીજા ક્વાર્ટર સુધી ૩-૦ની સરસાઈ મેળવીને પોતાની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી. ચોથા ક્વાર્ટરની શરૂઆતના માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે ૪૮મી મિનિટે અભિષેક ભારત માટે ચોથો ગોલ કર્યો. આ ગોલ સાથે ભારતે ૪-૦ની લીડ મેળવી

લીધી હતી. માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે ૫૧મી મિનિટે જાપાને પોતાનું ખાતું ખોલાવ્યું અને ટીમનો પહેલો ગોલ આવ્યો. ત્યારબાદ મેચ પુરી થવાના ૧ મિનિટ પહેલા ભારતે પાંચમો ગોલ કર્યો હતો. ૫૮મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ માટે પાંચમો ગોલ કરીને ભારતને જાપાન સામે ૫-૧થી જીત અપાવી હતી. ભારતના ૧૦૦ મેડલ ક્ષ્મ, અત્યાર સુધીમાં ૯૨ મેડલ જીત્યા છે. ભારત પાસે તીરંદાજીમાં ત્રણ, કબડ્ડીમાં બે, બેડમિન્ટનમાં, ક્રિકેટમાં એક, એક હોકીમાં છે. હોકીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતીય કુસ્તીબાજ અમાને પુરુષોની ૫૭ કિગ્રા ફ્રી સ્ટાઈલમાં ચીનના મિંગ્યુ લિયુને ૧૧-૦થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમાને ટેકનિકલ

શ્રેષ્ઠતાના આધારે ચીનના મિંગ્યુ લિયુને હરાવ્યું હતું. મહિલા ફ્રી સ્ટાઈલ ૭૬ કિગ્રા કુસ્તીમાં ભારતની કિરણે થાઈલેન્ડની અરિયુગાર્ગલ ગાનખતને ૬-૩થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોનમે મહિલાઓની ફ્રી સ્ટાઈલ ૬૨ કિગ્રા બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની જિયા લોંગને હરાવીને મેડલ જીત્યો હતો. ભારતના અતામુ, ધીરજ અને નુપારની પુરૂષ રિક્વર્વ ટીમે ફાઈનલમાં હારી ગઈ હતી અને તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતીય પુરૂષ કબડ્ડી ટીમે સેમી ફાઈનલમાં પાકિસ્તાનને ૬-૧-૧૪થી હરાવ્યું હતું. એશિયન ગેમ્સની મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં ભારતના અંચએસ પ્રણયને ચીનના લી શિફંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

## ન્યૂઝ બ્રિફ

### કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખસેડ્યા હોવાની શક્યતા

ભારત કેનેડા વચ્ચે તનાવપૂર્ણ સંબંધ જોવા મળી રહ્યા છે. એવામાં ભારતે કેનેડા પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા ૪૧ કેનેડીયન રાજદ્વારીઓને પાછા બોલવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ એવું કહ્યું હતું કે, ભારતમાં કેનેડા રાજદ્વારીઓની સંખ્યા વધારે છે જે આંતરિક બાબતોમાં દખલ આપે છે. જેને લઈ હાલમાં એક રીપોર્ટ દ્વારા સમાચાર મળી રહ્યા છે કે કેનેડાએ ભારતમાં સ્થિત હાઈ કમિશનમાંથી તેના રાજદ્વારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખસેડ્યા હોવાની જાણકારી મળી રહી છે. આ મામલે આવા દાવાઓ વચ્ચે કેનેડાના વિદેશમંત્રી મેલોની જોલીએ નિવેદન આપ્યું કે, સરકાર કર્મચારીઓમાં કાપના મુદ્દે ભારત સાથે રાજદ્વારી રીતે વાતચીત કરી રહી છે. જોલીએ જણાવ્યું કે, કેનેડા સતત ભારત સરકારના સંપર્કમાં છે. અમે કેનેડીયન રાજદ્વારીઓની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ, અને ખાનગી વાતચીત ચાલુ રાખીશું કારણ કે રાજદ્વારી વાતચીતો જ્યારે ખાનગી રહે છે ત્યારે શ્રેષ્ઠ કાર્ય કરે છે. અગાઉ એવો દાવો સામે આવ્યો હતો કે, ભારત- કેનેડા વચ્ચે બગડતા દ્વિપક્ષીય સંબંધો વચ્ચે ૧૦ ઓક્ટોબર સુધીમાં ભારતમાંથી ૪૧ રાજદ્વારીઓને પરત બોલવામાં આવે.

## ટ્વીટર ટૂંક સમયમાં ત્રણ પ્રકારના પ્લાન પણ લાવશે

ટ્વીટરના સીઈઓ લીડા યાકારીએ કહ્યું કે એક્સ ઓફ ટ્વીટરના સબસ્ક્રિપ્શન પ્લાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે આ વાત બેંકસ સાથે થયેલી મીટીંગમાં જણાવી હતી. હાલ કંપની એક્સપ્રીમિયમ માટે ૩ ૯૦૦ ચાર્જ કરે છે. નજીકના ભવિષ્યમાં ટ્વીટર ૩ પ્રકારના પ્લાન આપશે જેમાં બેઝીક, સ્ટાન્ડર્ડ અને પ્લસ પ્લાનનો સમાવેશ થશે. બ્લુસબર્નની એક રીપોર્ટ મુજબ, નવા ઓફર સબસ્ક્રિપ્શન પ્લાન આ સોશિયલ મીડિયા જાગૃત્તને એવા યુઝર્સ પાસેથી પણ આવક મેળવવામાં મદદ કરશે જેઓ હાલમાં મોંઘા પ્લાન નથી લેતા. થોડા સમય પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની વાતચીતમાં એલોન મસ્કે સંકેત આપ્યો હતો કે બોટ્સની સમસ્યાને ખતમ કરવા માટે એક્સપ્રીમિયમ પાસેથી નાની માસિક પેમેન્ટ લેવાનું શરૂ કરી શકે છે. એટલે કે દરેકને દિવર લોગિન માટે અમુક રકમ ચૂકવવી પડશે. થોડા સમય પહેલા એક સંશોધકે એક્સપર નવા એપ્લિકેશન વર્ઝન માટે એક નવા કોડની તપાસ કરી હતી જે દર્શાવે છે કે ટાઇપ સબસ્ક્રિપ્શન પ્લાનને યુઝર્સને બતાવવામાં આવતી જાહેરાતોની સંખ્યાના આધારે અલગ કરી શકાય છે. જેમાં પ્રીમિયમ બેઝીક પ્લાન બધી જ એડ બતાવશે જ્યારે પ્રીમિયમ સ્ટાન્ડર્ડ પ્લાનમાં અડધી જ એડ જોવા મળશે અને પ્રીમિયમ પ્લસમાં કોઈ જ જાહેરાતો જોવા મળશે નહિ. એટલે એવું કહી શકાય કે સસ્તું સબસ્ક્રિપ્શન લેનાર લોકોને સૌથી વધુ જાહેરાતો જોવા મળશે.

## ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી ગઈ ફાઈનલમાં

ભારતે પુરૂષ ક્રિકેટની પ્રથમ સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારત ગોલ્ડ મેડલથી એક પગલું દૂર છે. ભારતે જીત માટે ૯૭ રનનો ટાર્ગેટ ૧ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત સારી રહી ન હતી. ક્વાર્ટર ફાઈનલમાં સદી ફટકારનાર ઓપનર યશસ્વી જયસ્વાલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જોકે, કેપ્ટન રુતુરાજ ગાયકવાડે તિલક વર્મા સાથે મળીને ભારતીય દાવને સંભાળ્યો એટલું જ નહીં પણ શાનદાર બેટિંગ પણ કરી.



બંનેએ પ્રથમ ૩ ઓવરમાં સ્કોરને ૩૫ રનથી આગળ કરી દીધો હતો અને તે પછી પણ બંને રોકાયા નહોતા અને ૧૦મી ઓવરમાં જ ભારતને જીત અપાવી હતી. તિલક વર્માએ અડધી

સદી ફટકારી હતી. તેણે આ માટે ૨૫ રનથી આગળ કરી દીધો હતો અને તે પછી પણ બંને રોકાયા નહોતા અને ૧૦મી ઓવરમાં જ ભારતને જીત અપાવી હતી. તિલક વર્માએ અડધી

## શેપ ઓફ યુન ગાયક એડ શીરાન પોતાના માટે ફબર ખોદી રહ્યો છે

દુનિયાભરમાં પોતાના ગીતોથી લોકોને દિવાના બનાવનાર હોલિવૂડ સિંગર એડ શીરાન પોતાની ગાયકી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. એડ શીરાને 'શેપ ઓફ યુ' ગીતથી ખાસ ઓળખ મળી હતી પરંતુ હવે તે પોતાના મૃત્યુની કબર ખોદી રહ્યો છે. આ અજબ લાગણી પણ આ સત્ય છે. ૩૨ વર્ષીય સિંગરે એવું એટલા માટે કર્યું કારણ કે, તે ઈચ્છતો હતો કે, તેના મૃત્યુ બાદ તેનો આખો પરિવાર એક જ જગ્યાએ દફનાવવામાં આવે.



આ કોઈ ભોંયરું નથી. આ સ્થળનો વિચાર તેના પરિવારના સભ્યોને સાથે રાખવાથી આવ્યો હતો, જેમનો એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. શીરાને ઘરની પાછળના ભાગમાં જમીનમાં એક મોટો ખાડો બનાવ્યો છે અને તેની ઉપર એક નાનો પથ્થર મૂક્યો છે. સિંગર કહે છે કે જ્યારે પણ એ દિવસ આવશે, જ્યારે હું મરીશ, ત્યારે મને ત્યાં જ દફનાવી દેવામાં આવશે. મારા માટે આ કહેવું વિચિત્ર હશે, પરંતુ મારા ઘણા મિત્રો ઈચ્છા વિના મૃત્યુ પામ્યા છે, અને શું કરવું તે કોઈને ખબર નથી. ૨૦૧૭માં રીલિઝ થયેલું 'શેપ ઓફ યુ' સોંગ એટલું લોકપ્રિય બન્યું હતું કે, તેને માત્ર બ્રિટનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવ્યું હતું.

## ભ્રહ્માંડમાં બીજા ૧૩ ભ્રહ્માંડો પણ હોઈ શકે છે એક એસ્ટેરોઈડ પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના છે

જતાં તેના ટુકડાઓ ઉપરથી વાયુ મંડળ દૂર થઈ જતાં તે ટુકડાઓ ઠરી જઈ પાપાણ સમાન બની રહ્યા. આ પૈકીનો એક એસ્ટેરોઈડ (લઘુગ્રહ) પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના રહેલી છે. તેમ નાનાના વિજ્ઞાનીઓએ જણાવ્યું છે. આ એસ્ટેરોઈડ ૪ કરોડ વર્ષથી પણ પ્રાચીન હશે. તેની સાથે પૃથ્વીને ખાસ સંબંધ છે. તે ૧૯૯૯માં શોધાયો હતો. તેથી તેનું નામ ૧૯૯૯ આરક્યુડ અપાયું પરંતુ તે વિજ્ઞાનીઓ પૈકી એક વિજ્ઞાનીના પુત્રે તેના રમકડાનાં બેર જેને તે બેનું કહેતો હતો તે પરથી તે લઘુગ્રહનું નામ બેનુ રાખ્યું. આ લઘુગ્રહ ૬૨૨ ઇવર્ષ પૃથ્વી પાસેથી પસાર થાય છે.

સતલજના પાણી માટે સુપ્રીમના આદેશ બાદ માનની પ્રતિક્રિયા પંજાબ પાસે અન્ય રાજ્યને આપવા એક ટીપુંપણ પાણી નથી: ભગવંત માન અન્ય રાજ્યોને આપીએ છીએ, તેથી વધારે એક ટીપું પણ પાણી આપવાના નથી, પંજાબના મુખ્યપ્રધાનનો હુકાર

## સૈન્ય કેમ્પમાં અધિકારી દ્વારા ગોળીબારની ઘટના રાજૌરીમાં આતંકી હુમલો નહીં તો કોનો હાથ એ મોટો સવાલ અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં ૩ અધિકારી સહિત ઓછામાં ઓછા ૫ સૈન્યકર્મી ઘવાયા હતા

જમ્મુ, તા.૬ | જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે એક સૈન્ય કેમ્પમાં એક અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં ૩ અધિકારી સહિત ઓછામાં ઓછા ૫ સૈન્યકર્મી ઘવાયા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર પકડી લેવામાં સફળતા મળી હતી. આ ઘટના થાનામંડી નજીક નીલી કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર જ આ હુમલાને અંજામ આપ્યો હોવાનું

મનાય છે. તેણે પોતાના સહયોગીઓ પર ગોળીબાર કરી દીધો અને પછી યુનિટના હથિયારોના સંગ્રહસ્થાને જઈને છુપાઈ ગયો હતો. જ્યારે તેને આત્મસમર્પણ કરવા કહેવાયું તો તેણે વરિષ્ઠ અધિકારી સહિતના જવાનો પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કરી દીધો હતો. સૂત્રો અનુસાર આઠ કલાકની મહામહેનતે તેને પકડી લેવામાં સફળતા મળી હતી. આ ઘટના થાનામંડી નજીક નીલી ચોકી પર બની હતી. સૈન્યએ સાવચેતીના પગલાં સ્વરૂપે



મનાઈ રહ્યો છે. જોકે તે પ્રથમ મેચ રમી શકશે કે નહીં? આ મામલે સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.





**તમને પણ એકલા રહેવાનું ગમે છે? તમને પણ આ જાપાની બીમારી તો નથી ને..**



આપણે આપણા જીવનમાં ઘણા એવા લોકોને મળ્યા હોઈશું કે જેઓ બીડથી અલગ રહેવાનું પસંદ કરતાં હોય છે. આવા લોકો ભાગ્યે જ બહાર નીકળતાં હોય છે. આપણા લોકો માટે ૨૦૨૦માં લોકડાઉન આવ્યું હતું, પરંતુ આવા લોકો માટે આખું જીવન જ લોકડાઉન હોય છે. તમે કે હું ભલે આખો સમય ઘરમાં ગોંધાઈ રહેવાનું પસંદ ના કરીએ, પણ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ ૨૪ કલાક ઘરમાં ગોંધાઈ રહેવાનું પસંદ કરે છે, લોકોને હળવું-મળવું આ લોકોને પસંદ જ નથી હોતું. તેઓ બસ પોતાના જીવનમાં જ વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. પરંતુ, શું ક્યારેય એવું વિચાર્યું છે બસ કે આખરે આવું કેમ? કેમ આ લોકોને આ રીતે એકલા રહેવાનું પસંદ હોય છે? તો આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ આજે આપણે અહીં કરીશું. સૌથી પહેલાં તો એ જણાવીએ કે આ પ્રકારની પરિસ્થિતિ માટે હિકિકોમોરી શબ્દનો ઉપયોગ થાય છે. હિકિકોમોરી શબ્દનો ઉપયોગ જાપાનમાં જ થાય છે. આ શબ્દ જાપાનમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેનો ઉપયોગ એવા લોકો માટે થાય છે જેઓ સમાજથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે કે પછી એકાંતવાસનું જીવન જીવે છે. આવા લોકો ઘરમાં રહે છે, ત્યારે પણ તેઓ ઘણા દિવસો સુધી નહીં, પરંતુ ઘણા મહિનાઓ સુધી ઘરમાં જ ગોંધાઈ રહે છે અને બહાર આવતા નથી. જો આપણે આ શબ્દ વિશે વાત કરીએ તો, 'હિકિકોમોરી' જાપાની શબ્દ 'હિકી' પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે અંદરની તરફ ખેંચવું અથવા બંધ થવું અને 'કોમોરી' એટલે એકાંત. હિકિકોમોરી એક એવી સ્થિતિ છે જેમાં અલગ થવું માત્ર એક મુદ્દો નથી, એ એક માનસિક તકલીફ છે. આ તણાવ અથવા ડિપ્રેશન જેવી કોઈપણ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનું લક્ષણ હોઈ શકે છે. હિકિકોમોરીના ચોક્કસ કારણો સંપૂર્ણપણે સમજ શક્યા નથી, પરંતુ માનવામાં આવે છે કે તેમાં સામાજિક દબાણ, નિષ્ફળતા, ભાવનાત્મક સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે. હિકિકોમોરી એ જાપાનમાં આ એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો છે અને એવું માનવામાં આવે છે કે ત્યાં આવા અડધો મિલિયનથી વધુ મિલિયન લોકો છે.

**આ મંદિરની મૂર્તિમાં ઘબડકે છે ભગવાન કૃષ્ણનું હૃદય**

**હિંદુ ધર્મ અનુસાર બદરીનાથ, હારકા, રામેશ્વરમ અને પુરી ચાર ધામ છે**

પુરીના જગન્નાથ મંદિરમાં ૧૨ વર્ષ બાદ ભગવાનની મૂર્તિઓ બદલવામાં આવે છે. મૂર્તિ બદલતી વખતે, પૂજારી આંખ પર પટ્ટી બાંધે છે અને મંદિરમાં અંધારું કરવામાં આવે છે. જગન્નાથ મંદિરનું રહસ્ય હિંદુ ધર્મ અનુસાર બદરીનાથ, હારકા, રામેશ્વરમ અને પુરી ચાર ધામ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર ધામ પર સ્થાયી થયા હતા, ત્યારે તેઓ પહેલા બદરીનાથ ગયા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું, ત્યારબાદ તેઓ ગુજરાતના હારકા ગયા હતા અને ત્યાં કપડાં બદલ્યા હતા. હારકા પછી તેમણે ઓડિશાના પુરીમાં બપોરનું ભોજન લીધું અને છેલ્લે તામિલનાડુના રામેશ્વરમ ખાતે આરામ કર્યો. પુરીમાં ભગવાન શ્રીજગન્નાથનું મંદિર છે. પુરીના આ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની કાસ્ટની મૂર્તિઓ છે. લાકડાના શિલ્પો સાથેનું આ અનોખું મંદિર છે.



જગન્નાથ મંદિરની આવી ઘણી વિશેષતાઓ છે, સાથે જ મંદિર સાથે જોડાયેલી એવી ઘણી વાર્તાઓ છે જે સદીઓથી રહસ્ય બનીને રહી છે. દર ૧૨ વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે જગન્નાથ પુરી મંદિરની ત્રણેય મૂર્તિઓ દર બાર વર્ષે બદલવામાં આવે છે. જૂની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ બદલવાની આ પ્રક્રિયા સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો પણ છે. જ્યારે મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે સમગ્ર શહેરમાં વીજળી ડુલ થઈ જાય છે. જગન્નાથ મંદિરની આસપાસ

સંપૂર્ણ અંધારું હોય છે. મંદિરની બહાર સુરક્ષા તેનાત હોય છે. એ સમયે મંદિરમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે. મંદિરમાં ફક્ત તે જ પૂજારીઓને પ્રવેશ આપવામાં આવે છે જેમણે મૂર્તિઓ બદલવાની હોય છે. પૂજારીની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે. હાથમાં મોજા પહેરવામાં આવે છે. આ પછી મૂર્તિઓ બદલવાની પ્રક્રિયા શરૂ થાય છે. જૂની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓ બદલવામાં આવે છે, પરંતુ એક વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી, તે છે બ્રહ્મ પદાર્થ. જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં



**પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી, એ જવાબદારી આપણી**

વિશ્વમાં સૌ પ્રથમ પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ ઈસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતા- વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા હતા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે. ત્યાર પછી પાંચમી જૂન ૧૯૭૨ ના રોજ સંયુક્ત રાષ્ટ્રે આ દિવસનો પાયો નાખ્યો હતો. ત્યારથી દર વર્ષે પાંચમી જૂનના દિવસને 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પહેલી વાર વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન ૧૯૭૨ના રોજ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઉજવવામાં આવ્યો હતો. તે સમયે વિશ્વના કુલ ૧૧૯ દેશોએ ભાગ લીધો હતો. પ્રથમ પર્યાવરણ દિવસ પર ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ ભારતની પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે તેમની ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર પછી ૧૯૭૪ માં અમેરિકાના સ્પ ડેનમાં પ્રથમ વખત 'ઓન્લી વન અર્થ' થીમ સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી. સન ૧૯૮૭માં વિવ પર્યાવરણ દિવસની ઉજવણી જુદા જુદા દેશોના યજમાન પદ હેઠળ જોવાનું નક્કી કરવામાં આવ્યું. જે અન્યથે વર્ષ ૨૦૧૮ માં ૪૫મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો નિર્ભર છીએ.

**સ્ટ્રેસ બસ્ટર તો છે જ, પણ બીજા ફાયદાઓ જાણશો તો ઉછળી પડશો**

સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ તો આપણે બધા જ જોઈ હશે અને એમાં સંજુબાબા આપણને જાદૂ કી જપ્પી એટલે કે આલિંગન આપવાના મહત્ત્વથી પરિચિત કર્યા હતા અને સમજાવ્યું હતું કે આલિંગન કરવાથી ઘણી સમસ્યાઓનો અંત આવે છે. આવું અમે નહીં પણ હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે સ્વાસ્થ્ય માટે એક જાદૂ કી જપ્પી ખૂબ જ જરૂરી છે. આરોગ્ય સિવાય પણ ગળે મળવાના બીજા ફાયદાઓ જોવા મળે અને આપણે આ



ફાયદાઓ વિશે આપણે અહીં વાત કરવાના છીએ. જો કોઈ વ્યક્તિ એકબીજાને ગળે લગાવે છે, તો રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત છે. આલિંગન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. તેનાથી રક્ત પ્રિરબ્ધ પણ વધે છે અને તેની અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે.

આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે માત્ર ૨૦ સેકન્ડ હાથ કરવાથી બ્લડપ્રેશરનું લેવલ જળવાઈ રહે છે. જેના કારણે હૃદયનું સ્વાસ્થ્ય બરાબર રીતે જળવાઈ રહે છે અને બીપી કન્ટ્રોલમાં રહે છે. આલિંગનથી આપવાને કારણે હાર્ટનું આરોગ્ય પણ સુધરે છે. અનેક કપલ્સ વચ્ચે આ બાબતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં અમુક યુગલોને ૧૦ મિનિટ માટે એકબીજાના હાથ પકડી રાખવાનું જણાવવામાં આવ્યું હતું અને કેટલાકને ૨૦ સેકન્ડ માટે આલિંગન કરવાનું કહેવામાં આવ્યું હતું.

**BOLLYWOOD NEWS FLASH**

**સ્વરા ભાસ્કર માતૃત્વ જીવનનો આનંદ માણે છે**

સ્વરા ભાસ્કરની ગણતરી બોલિવૂડની સ્પષ્ટવક્તા અભિનેત્રીઓમાં થાય છે. તે અવારનવાર કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. તેણે આ વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ ફાદ અહમદ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. આવું જ કંઈક તે જ્યારે માતા બની ત્યારે જોવા મળ્યું હતું.

**પ્રજ્ઞા જયસ્વાલની લેટેસ્ટ તસવીરોએ મયાવ્યો હંગામો**

પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે. પ્રજ્ઞા જયસ્વાલે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તેણે નક્ષત્રમ અને અખંડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ૧૨ જાન્યુઆરી ૧૯૮૮ ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિચી' લાંટી કુરાહુ, 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ ૨૦૧૪ માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ સાથે અભિનયની શરૂઆત કરી હતી. વિરાટ માટે, તેણીને ૬૩મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૪ માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યુ કર્યું હતું અને આમાં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જયસ્વાલને તેલુગુ પીરિયડ ડ્રામા કાંચે (૨૦૧૫) સાથે પણ સફળતા મળી, જેના માટે તેણીને શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો સાઉથ એવોર્ડ આપવામાં આવ્યો જયસ્વાલે 'ટીટુ એમબીએ'થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. પરકેટ્ટ શેપ બનાવવા જતા હાલત બગડી.

**શ્રી દેવી જ નહી, ઘણી એક્ટ્રેસે ફોલો કરેલું છે**


શ્રીદેવીએ ૧૯૭૯માં 'સોલવણ સાલ'થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી. પરંતુ, એકશન ફિલ્મ 'હિમ્મતવાલા'એ તેને ઓળખ આપી. આ ફિલ્મ પછી શ્રીદેવી મોટા પડદા પર એટલી હદે દબાઈ ગઈ કે, મોટા મોટા સુપરસ્ટાર્સનું સ્ટારડમ પણ તેની સામે ઝાંખા થવા લાગ્યા. શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ૨૦૧૭માં રિલીઝ થયેલી 'મોમ' હતી, જેમાં તે ફરી એકવાર દર્શકોના દિલ જીતવામાં સફળ રહી હતી. પરંતુ, ૨૦૧૮ માં, શ્રીદેવી વિશે એક સમાચાર આવ્યા, જેણે તેના ફેન્સને હચમચાવી દીધા હતા. આ સમાચાર તેમના નિધનના હતા. ફેબ્રુઆરી ૨૦૧૮ માં, પાપારાઝીએ અભિનેત્રીને ઇલેલીવાર એરપોર્ટ પર જોયો હતો. આ દરમિયાન શ્રીદેવી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની સ્ટાઈલ, લુક અને ફિટનેસ હંમેશાની જેમ જ હતી. અભિનેત્રી પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી કપૂર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

**ઉર્વશી રૌતેલાનો હોટ જિમ વર્કઆઉટનો વીડિયો વાયરલ**

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એકવાર સમાચારોમાં ચમકી છે. ઉર્વશી ભલે ઓછી ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેની પોપ્યુલારિટી જબરદસ્ત છે. સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવનાર કેટલાક સિલેક્ટેડ સેલેબ્સમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ સામેલ છે. હાલમાં અભિનેત્રીનો શાનદાર જિમ લૂકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ જિમ લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. જિમ વર્કઆઉટ દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાને ફિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડે છે. એક્ટ્રેસ જાણે છે કે પોતાને ફિટ રાખવા માટે શું કરવું અને એક્ટ્રા કેલરી કેવી રીતે બર્ન કરવી. ઉર્વશી રૌતેલા ફક્ત એક્ટિંગ જ નહીં પરંતુ ડાન્સ, ફિટનેસ અને તેનાં જબરદસ્ત ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. અભિનેત્રી તેનાં નવાં વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રીના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા જિમમાં જાય છે. આ વીડિયોમાં એક્ટ્રેસ જિમમાં કસરત કરતી જોવા મળે છે. ઉર્વશી રૌતેલાએ તેનાં ફેન્સને પ્રેરિત કરવાં માટે તેનો નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે તેનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળે છે. ફેન્સ પણ ઉર્વશી રૌતેલાનું વર્કઆઉટ જોઈને દંગ રહી ગયા છે. તેઓ કમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસનાં વર્કઆઉટનાં વખાણ કરી રહ્યાં છે. અભિનેત્રીના ચાહકો ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો પર ફાયર ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. ઉર્વશી રૌતેલાના આ ફિટનેસ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

**અભિનેતા રાજેશ ખન્નાને મેહમૂદે માર્યો હતો થપ્પડ**

૯૦ના દશકના એ કલાકારો જેઓ પોતાના પાત્રોમાં પ્રાણ ફૂંકતા હતા. તેમણે તેના લગભગ દરેક પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કર્યો. હંમેશા એવી ભૂમિકાઓ ભજવી જે લોકોનું ધ્યાન ખેંચે. તેણે માત્ર અભિનય જ નહીં પરંતુ ટિગ્ડર્શનમાં પણ ઘણી સફળતા મેળવી હતી. ૧૯૭૪માં રિલીઝ થયેલી તેમની એક ફિલ્મે લોકોના દિલ જીતી લીધા હતા. આ બ્લોકબસ્ટર જોઈને થિયેટરમાં બેઠેલા દરેકની આંખો ભીની થઈ ગઈ. જાણો કોણ હતા તે સુપરસ્ટાર. ૭૦ના દાયકામાં પોતાની એક્ટિંગ અને કોમેડીથી લોકોનું દિલ જીતનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મેહમૂદ હતા. મેહમૂદે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જે બ્લોકબસ્ટર હતી. કોમેડીમાં તેની બરાબરી નહોતી. જ્યારે પણ તે સ્ક્રીન પર દેખાયો ત્યારે તેના ચહેરાના હાવભાવ જોઈને લોકો હસવા માટે મજબૂર થઈ જતા હતા. વર્ષ ૧૯૭૪માં રિલીઝ થયેલી તેની એક બ્લોકબસ્ટરે ધમાકો મચાવ્યો હતો. ફિલ્મનું નામ હતું 'કુંવારા બાપ'. કહેવાય છે કે આ ફિલ્મ તેમના વાસ્તવિક જીવન પર આધારિત હતી. ફિલ્મમાં, મેહમૂદે એક ગરીબ રિક્ષાચાલકની ભૂમિકા ભજવી હતી જે પોલિયોથી પીડિત તેના ૧૫ વર્ષના પુત્રની સારવાર માટે દિવસ-રાત કામ કરે છે. ફિલ્મમાં તેમના પુત્રની ભૂમિકા તેમના વાસ્તવિક જીવનના ત્રીજા પુત્ર મકદૂમ અલીએ ભજવી હતી, જે બરેબર પોલિયોથી પીડિત હતો. મેહમૂદે તેના પુત્ર મકદૂમની ઘણી સારવાર કરાવી પરંતુ તે સાજો થઈ શક્યો નહીં. એક ખાસ સંદેશ આપતી આ ફિલ્મમાં અભિનેતાએ એ બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે વાસ્તવિક જીવનમાં આટલા અમીર હોવા છતાં આટલા પૈસા લગાવવા છતાં તે પોતાના પુત્રની સારવાર કરાવી શક્યો નથી. પરંતુ ફિલ્મમાં એક ગરીબ રિક્ષાચાલક પિતાની શું હાલત હશે જેની પાસે પૈસા પણ નથી અને તે પોતાના બાળકની સારવાર કરાવવા માંગે છે. ફિલ્મ સાથે એટલી બધી લાગણીઓ જોડાયેલી છે કે આજે પણ તમે આ ફિલ્મ જોશો તો તમારી આંખો ભીની થઈ જશે. તમને જણાવી દઈએ કે મેહમૂદે એક્ટિંગની સાથે ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. વર્ષ ૧૯૭૯માં જ્યારે તેઓ ફિલ્મ 'જનતા હલવદર' બનાવી રહ્યા હતા ત્યારે તેમણે આ ફિલ્મમાં ૨૧ જી શ ખશાને કાસ્ટ કર્યો હતો.



# વન્યજીવ સપ્તાહની ઉજવણી નિમિત્તે બાલારામ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ઉજાણી - નેચર એજ્યુકેશન એન્ડ ઈકોટુરિઝમ કેમ્પ સાઈટનું લોકાર્પણ કરાશે

## બાલારામ ઉજાણી કેમ્પ સાઈટ ખાતે ભાવિ પેઢીને પ્રકૃતિ અને વન્યજીવનને નજીકથી સમજવાનો અને તેની સાથે સંવેદના કેળવવાનો અવસર મળશે

વન્યજીવ સપ્તાહની ઉજવણી-૨૦૨૩ નિમિત્તે રાજ્યના વન વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના બાલારામ ખાતે તૈયાર કરવામાં આવેલ ઉજાણી-નેચર એજ્યુકેશન એન્ડ ઈકોટુરિઝમ કેમ્પ સાઈટનું લોકાર્પણ તા. ૭ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે-૧૦.૦૦ કલાકે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાયમન્ટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના વરદહસ્તે કરવામાં આવશે. બાલારામ ઉજાણી ગૃહ ચિત્રાસણી ખાતે અંદાજીત ૫ હેક્ટર વિસ્તારમાં નેચર એજ્યુકેશન એન્ડ ઈકોટુરિઝમ કેમ્પ સાઈટ બનાવવામાં આવી છે. ઉજાણી માટે ઈકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી, ચિત્રાસણીની રચના પણ કરવામાં આવી છે અને ઈકો ટુરિઝમના ઉદ્દેશ્યથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.



મુકાયેલી પ્રજાતિઓના પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવાના લાંબા ગાળાના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હતી. આ વખતે ૬૯ મો **Partnership for Wildlife Conservation**ની થીમ સાથે વન્યપ્રાણી સમાહની ઉજવણી કરવામાં આવે છે. આ સમાહ દરમિયાન ગુજરાત રાજ્યમાં વન વિભાગ દ્વારા બહુ મોટા પાયે જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવે છે. આ દિવસોમાં વન વિભાગ વિવિધ સેવાભાવી સંસ્થાઓની સાથે રહીને લોકભાગીદારીથી આવા પ્રયાસો કરે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, બિન સરકારી સંગઠનો, સરકારના અન્ય વિભાગો વગેરે સાથે રહીને વન્ય જીવો પ્રત્યે જનજાગૃતિ જળવાય એવા પ્રયાસો કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શેરી નાટકો, સભાઓ, વન વિસ્તારોમાં ભ્રમણ (Jungle tracking), પક્ષી નિદર્શન કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને બાળકો વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃત થાય એ માટે વિવિધ શાળા અને કોલેજોમાં વન્ય જીવ સંરક્ષણ સંબંધિત સેમિનાર, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રેલી, નાટકો વગેરેનું આયોજન કરવામાં આવે છે.

વન્યજીવ સંપદાની દ્રષ્ટીએ બનાસકાંઠા જિલ્લો ખુબ જ મહત્વની જૈવ વિવિધતા ધરાવે છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતું બનાસકાંઠા વન્યજીવ વિભાગ ૧૮૫૬ થી વન તથા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનમાં સતત કાર્યરત છે. બનાસકાંઠા વન્યજીવ વિભાગમાં મુખ્યત્વે ત્રણ અભયારણ્ય આવેલા છે. જેમાં જેસોર રીંછ અભયારણ્ય, બાલારામ-અંબાજી અભયારણ્ય તેમજ ઘુડખર અભયારણ્યનો ભાગ આવેલ છે. અહીં રીંછ, દીપડા ઘુડખર, વરૂ, ચીંકારા, ઘોરખોટીયું, કીડીખાઉ, કાટવણી બિલાડી, વણીયર જેવા અતિ મહત્વના પ્રાણીઓ તેમજ વનસ્પતિ સુષીની જૈવ વિવિધતાનો ભાગનો છે. અહીંના બાલારામ-અંબાજી તથા જેસોર

વન્યજીવ અભયારણ્યોમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ૪૮૭ થી વધુ પ્રકારની વનસ્પતિ, ૨૧૨ પ્રકારના પક્ષીઓ, ૩૦ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૫ પ્રકારના સરીસૃપ, ૧૨ પ્રકારના ઉભયજીવી, ૧૫૭ પ્રકારના કરોળીયાની જાતિ તથા ૩૨ પ્રકારની ફૂગ નોંધવામાં આવેલ છે. ઘુડખર વન્યપ્રાણી અભયારણ્યમાં ઘુડખર તેમજ વિવિધ યાચાવર પક્ષીઓના સંરક્ષણ તેમજ સંવર્ધનથી જૈવસૃષ્ટિમાં સતત વધારો થઈ રહેલો જોવા મળે છે. આ વન્યજીવોના સંરક્ષણ માટે ફળાઉ વૃક્ષોનું વાવેતર, પવન ચક્કી દ્વારા પાણીની સુવિધા, ટ્રેપ કેમેરા, ફેરણ, ચેકડેમ, વન તળાવડી, ગાજલર, કૃત્રિમ રાફડા, કૃત્રિમ ગુફાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીં રેડ જંગલ ફાઉલ તથા ચિત્તલનું સંવર્ધન કેન્દ્ર તેમજ વરૂ સોફ્ટ રીલીફ સેન્ટર થકી વન્યજીવોના સંવર્ધનની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બનાસકાંઠા વન વિભાગની આ સઘન પ્રવૃત્તિઓ દ્વારા સંરક્ષણ અને સંવર્ધનના પ્રયાસો હાથ

ધરવામાં આવ્યા છે. જેના ફળસ્વરૂપે ગુજરાતમાં રીંછ તથા ઈજિપ્શન ગીધની સૌથી વધુ વસ્તી બનાસકાંઠામાં નોંધાયેલ છે. વર્ષ-૨૦૧૬-૧૭ માં ચિત્તલ સંવર્ધન કેન્દ્રમાં પ ચિત્તલ સાથે શરૂ કરવામાં આવેલ ચિત્તલની સંખ્યા હાલ ૨૩ સુધી પહોંચી છે. જેમાંથી અમુક સંખ્યામાં યોગ્ય જોડીમાં આ ચિત્તલને જેસોરના જંગલમાં મુક્ત કરવામાં આવશે. ત્યાં જ રેડ જંગલનું પણ બ્રિડીંગ સેન્ટર આવેલ છે. તાજેતરમાં નવા નડાબેટ ખાતે **Wolf soft release centre** પણ વિકાસ કરવામાં આવ્યું છે. બાલારામ-અંબાજી અભયારણ્યમાં આવેલ એનિમલ કેર સેન્ટર થકી વન્યપ્રાણીઓના બચાવ તેમજ સારવાર બાબતે પશુ ચિકિત્સક સહિત વન વિભાગની કુશળ ટુકડી દિવસ રાત સતત કાર્યરત રહી આ જિલ્લા સહિત સંલગ્ન અન્ય જિલ્લાઓમાં પણ વન્યપ્રાણીઓના બચાવ અભિયાનની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે.

## જામનગરમાં આજે હજારો ઘોરા બિરાદરોએ સૈયદના સાહેબના દર્શન કરી ધન્યતા અનુભવી

। હુસામુદ્દીન કપાસી જસદણ, તા.૬ । જામનગરમાં વિશ્વભરના દાઉદી ઘોરા સમાજના ત્રેપનમા દાઉદી (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર સૈયદના અબુ જાફર સ્વાદીક આલિકદર મુકદ્દલ સૈયદીન (ત.ઉ.શ.) એ ઘોરા સમાજનાં મહાન ઓલિયા ઈસ્માઈલ બદરુદ્દીન સાહેબના મઝાર પર ખાસ પધરામણી કરી હોય ત્યારે જામનગરમાં સૌરાષ્ટ્રના અનેક ગામોના હજારો ઘોરા બિરાદરોએ સૈયદના સાહેબના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમાજમાં જેમનો પડયો બોલ ઝીલાય છે એવા માનવતાવાદી નામદાર ડો. સૈયદના સાહેબ નવ મહિના પછી લાંબા સમય બાદ જામનગર પધાર્યા હોવાથી સૌરાષ્ટ્રના ગામેગામના ઘોરા સમાજના હજારો ભાઈ બહેનોએ આજે શુક્રવારે તેમની ઈમામત હેઠળ નમાઝ પઢી હતી અને તેમનાં દીદાર કરી ધન્યતા અનુભવી હતી સૈયદના સાહેબ આજે પોતાનાં પરિવારના ખાસ સુંદા સભ્યો સાથે સર્ગંગ તેર દીવસમાં સોળ ગામનો પ્રવાસ કરશે સાંજે જામનગરથી જામ પંભાળીયા જશે અને આજે રાત્રિ રોકાણ પોરબંદર કરશે જામનગર બાવાફળીમાં રેહતા સામાજિક કાર્યકર અબ્બાસભાઈ એફ અત્તરવાળાએ જણાવ્યું હતું કે આજે ઘણાં સમય પછી જામનગરના આંગણે સૈયદના સાહેબની દિવ્યતાનો લાભ મળ્યો હતો તે અમો આજીવન ભુલી નહી શકીએ અને ભુસી પણ નહી શકીએ અબ્બાસભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જામનગરમાં આજે સૈયદના સાહેબના આગમન સમયે ખાસ કરીને મઝારમાં જીયારતના સમયમાં ફેરફાર કરાયો છે બીજી બાજુ નમાઝ અને જીયારત માટે સ્થાનિક અમિલ



સાહેબ મુસ્તાલીભાઈ સાહેબે જે ગોઠવણ કરી હતી તેને કારણે તાજદાર ડો. સૈયદના સાહેબના દીદાર અમારાં જેવાં બુચુરોને પણ આરામથી થઈ શકે જામનગરનું આયોજન કાબિલે દાદ રહ્યું હતું રાજકોટના દાઉદી ઘોરા સમાજના મહિલા આગેવાન દુરૈયાબેન એસ મુસાણીએ જણાવ્યું હતું કે જેમનાં દીદારથી બેડો પાર થઈ જાય એવાં તાજદાર સૈયદના સાહેબ આગામી દિવસોમાં રાજકોટ પધરામણી કરે તે માટે હું અને અમારાં ગ્રુપની બહેનો બે વખત જામનગર ખુલ્લા પગે જીયારત માટે આવ્યાં હતાં હવે બહુ જ ટૂંકા ગાળામાં સૈયદના સાહેબ રાજકોટ પધરામણી કરે છે એટલે અમારી મનોકામના સિદ્ધ થશે અને નોંધનીય છે કે વિશ્વ લોક કલ્યાણકારી ડો. સૈયદના સાહેબ આજે રાત્રિ રોકાણ પોરબંદર કરી કાલ સવારથી સૌરાષ્ટ્રના કેટલાંક ગામોનો પ્રવાસ વેગવંતો બનાવશે આ અંગે તૈયારીને આપરી ઓપ અપાયો છે.



તાલુકા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું

। ભરતભાઈ એ. પંડ્યા દિવડા કોલોની, તા.૬ । તાલુકા કાનૂની સેવા સમિતિ કડાણા અંતર્ગત ઔદ્યોગિક તાલિમ સંસ્થા લિભોલા મુકામે પી. એલ. વી. એચ. એ. જોષી એ કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરી પોકસો તથા સરકારી કાયદાઓ અને યોજનાઓ વિષે સમજ આપી તાલિમ સંસ્થાના બાળકો ને જાણકારી આપી હતી.

## બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરણાથી નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે ધાર્મિક પ્રવાસ સંપન્ન

### વડીલોએ બોટાદથી સાળંગપુર, રોહીશાળા અને ઉગામેડી સહિતના સ્થળોની મુલાકાત લીધી



। બોટાદ, તા.૬ ।

“વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ” કાર્યક્રમની ઉજવણીના પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયની પ્રેરણા અને માર્ગદર્શનથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે ધાર્મિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જિલ્લાના ૫૦ જેટલા નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદની શ્રીજી ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી ખાસ ધાર્મિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રવાસનો શુભારંભ સવારે ૧૦ કલાકથી થયો હતો અને તમામને સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવના દર્શનાર્થે લઈ જવાયા હતા, મંદિરે દર્શન અને પ્રસાદ લઈ તમામને રોહીશાળા ખાતે ખોડિયાર માતાના મંદિરે લઈ જવાયા હતા. ત્યારબાદ બોટાદ જિલ્લાનું ઉભરતું પ્રવાસન સ્થળ ઉગામેડી ખાતે તમામને બોટીંગ કરાવાયું સાથેસાથે ટેલિસ્કોપ વડે આકાશ દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ધાર્મિક પ્રવાસે જનારા તમામ નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝનને સવારે ૧૦ વાગ્યે તેમના ઘરેથી લઈ સાંજે ઘરે પરત મુકવામાં આવ્યા હતા. નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝનને તેમના રોજિંદા જીવનથી કંઈક અલગ રીતે ધાર્મિક માહોલ વચ્ચે સમગ્ર દિવસ પસાર થાય તેવું અનોખું આયોજન જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે કરવામાં આવ્યું હતું. પૂરતી સંભાળ અને ખુશનુમા વાતાવરણ વચ્ચે વડીલોનો દિવસ પસાર થતા તમામે આનંદ અને હૃદયની લાગણી અનુભવી હતી.

## આજનું રાશિ ભવિષ્ય.....

**મેષ (મ,લ,ઇ) :** આજના દિવસે સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. તાઝ પૈસા ત્યારેજ તમારા કામ માં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળ થી તમે પછતાશો? તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે.

**વૃષભ (બ,વ,ઉ) :** આજના દિવસે ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજવસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. ભાઈ બહેનો ની મદદ થી આજે તમને આર્થિક લાભ મળી શકશે? પોતાના ભાઈ બહેનો ની સલાહ લો. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે.

**મિથુન (ક,ઇ,ઘ) :** આજના દિવસે તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લડ પ્રેશરના દરદીઓ. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે. સમય કરતા મોટું કંઈ હોતું નથી.

**કર્ક (સ,ઠ) :** આજના દિવસે તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો. પરિવાર ના કોઈ સભ્ય ના માંદા પાડવા થી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે, જોકે આ સમયે તમને ધન કરતા પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ?

**સિંહ (મ,ર) :** આજના દિવસે તમારી જાતને એક હદ કરતાં વધુ ક્યવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો. કોઈ નજીક ના મિત્રો થી અમુક વેપારીઓ ને સારું ધન લાભ થવા ની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓ ને દૂર કરી શકે છે. તમારો ફાજલ સમય ઘરના સુશોભિકરણ પાછળ લગાડો. તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે.

**કન્યા (પ,ઠ,ણ) :** આજના દિવસે તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કામમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો છો? તમારા અનિશ્ચિત વર્તન છતાં જીવનસાથી સહકાર આપશે.

**તુલા (ર,ત) :** આજના દિવસે વધુ પડતી કેલેરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો. જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલત માં આજે પૈસા પાછા આપવા પડી શકે છે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં.

**વૃશ્ચિક (ન,ય) :** આજના દિવસે તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરનો સમય આપશે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસા ની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસા નું શું મહત્વ હોય છે. નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે, જોકે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે.

**ધન (ભ,ધ,ફ) :** આજના દિવસે ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે.

**મકર (મ,જ) :** આજના દિવસે આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દાર ખોલશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે.

**કુંભ (ગ,શ,સ) :** આજના દિવસે તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉદ્દવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. આજે તમારા ઓફિસે માં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાન નું ધ્યાન રાખવું જરૂર છે. તમારી પાસેના ફાજલ સમયનો લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો.

**મીન (દ,ચ,ઝ,થ) :** આજના દિવસે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. મનોરંજન અથવા કોન્સર્ટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે.

# ભારત-કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાનો વિવાદ પૂર્વનાજી સૈનિકના સન્માન બદલ પુટિને ટ્રુડોની ઝાટકણી કાઢી

પુટિને કેનેડાના આ પગલાંને વાહિયાત ગણાવ્યું સાથે જ યુકેન પર ફેબ્રુઆરીમાં હુમલો કરવાના રશિયાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો

ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે પહેલાંથી મુશ્કેલીમાં મુકાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર વારાફરતી વૈશ્વિક નેતાઓ ભડકી રહ્યા છે ત્યારે આ વખતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને તેમનો ઉધડો લીધો હતો. જોકે પુટિને ટ્રુડો સરકારને બીજા કારણોસર આડેહાથ લીધી હતી. માહિતી અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનેએ પૂર્વ નાજી સૈનિકનું સંસદમાં સન્માન કરવા બદલ કેનેડાની આકરી ઝાટકણી કાઢી હતી. પુટિને કેનેડાના આ પગલાંને વાહિયાત ગણાવ્યું હતું. સાથે જ યુકેન પર ગત વર્ષ ફેબ્રુઆરીમાં હુમલો કરવાના રશિયાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. પુટિને કેનેડાની એવા સમયે ટીકા કરી છે જ્યારે ખાલિસ્તાની



આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ભારત સાથે તેના સંબંધો તણાવપૂર્ણ છે. ખરેખર ગત મહિને યુકેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી કેનેડા ગયા હતા. અહીં કેનેડાની સંસદને સંબોધી હતી. તે સમયે બીજા વિશ્વયુદ્ધમાં એડોલ્ફ હિટલર તરફથી લડનારા નાજી સૈનિક યારોસ્લાવ હુંકાને બોલાવવા હતા. કેનેડાના સ્પીકર એન્થની રોટાએ હુંકાને અસલ હીરો ગણાવ્યા હતા. તેના બાદ કેનેડિયન સાંસદોએ ઊભા થઈને તાળીઓ વગાડી નાજી સૈનિકનું સ્વાગત કર્યું હતું.

# ભારતના પેટ્રોલિયમ પ્રધાનની ખુલ્લી વાત રશિયા પાસેથી સસ્તું ઓઈલ દેશ-વૈશ્વિક હિતોને ધ્યાનમાં રાખીને ખરીદ્યું : પુરી

પુરીએ રશિયા પાસેથી સસ્તુ કુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોના હિત અંગે વાત કરી

ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલ ઓઈલ એન્ડ ગેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં તેમણે રશિયા પાસેથી સસ્તુ કુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ ૨૦૦૮ની મંદી અંગેનો પણ ઉલ્લેખ કર્યો છે. અબુધાબીમાં તેમણે વૈશ્વિક કુડ તેલની ખરીદીમાં ભારતની હિસ્સો અને કુડ ઓઈલની કિંમતો અંગે ભારતના વલણ પર ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે, રશિયા પાસેથી સસ્તુ કુડ ખરીદવાની ભારતની યોજનામાં દેશના નાગરિકોના હિતોનું ઉપરાંત વૈશ્વિક હિતોનું પણ ધ્યાન રખાયું છે. અન્યથા ૨૦૦૮ની મંદી જેવી સ્થિતિ સર્જવાની આશંકાને ટાળી શકાય તેમ નથી. એડીઆઈ પીઈસી ઓઈલ એન્ડ ગેસ કોન્ફરન્સના ભાગ લેતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વિશ્વભરમાં કુડ તેલની વધતી કિંમતો અંગે ચિંતા વ્યક્ત



કરી છે. તેમણે સંભાવના વ્યક્ત કરી છે કે, કુડ ઓઈલની વધતી કિંમતો લાંબા સમય સુધી સંકટ લાવી શકે છે, જેના કારણે ૨૦૦૮ જેવું આર્થિક સંકટ ફરી જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, ભારત સરકારની સૌપ્રથમ પ્રાથમિકતા પોતાના નાગરિકોને સસ્તું ઈંધણ અને પેટ્રોલ-ડીઝલ ઉલભ્ય કરાવવાની છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, રશિયા પાસેથી સસ્તુ કુડ તેલ ખરીદવાનો ભારતનો નિર્ણય કોઈપણ દેશની વિરુદ્ધમાં નથી, પરંતુ ભારતના નાગરિકો પ્રત્યે જવાબદારી સંભાળવાનું પ્રતિક છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હું ભારત દ્વારા રશિયા પાસેથી કુડ તેલ ખરીદી પર પશ્ચિમી પાખંડની નિંદા કરું છું.

# વિશેષ ઇન્ડોડા પાર્ક-ગાંધીનગર ખાતે આકર્ષણ સમાન દીપડાની નવીન જોડી 'શ્રવણ' અને 'રક્ષા'ને મુલાકાતીઓ નિહાળી શકશે

# વન્યજીવ સપ્તાહ નિમિત્તે ઇન્ડોડા પાર્ક-ગાંધીનગરમાં 'વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી એક્ઝિબિશન' તા. ૦૮ ઓક્ટોબર સુધી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું

વન્ય જીવ પ્રાણીઓ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ઇન્ડોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે દીપડાની નવીન જોડી 'શ્રવણ' અને 'રક્ષા'ને ગત તા. ૦૧ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ સક્કરભાગ પ્રાણી સંપ્રદાયલયથી લાવવામાં આવ્યાં હતાં. આ જોડીને કેવોરન્ટાઈનમાં રાખી સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવી હતી. આ સમયગાળો પૂર્ણ થતાં વન્યજીવ સપ્તાહ -૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે આજે તા. ૦૬ ઓક્ટોબર-૨૦૨૩થી પ્રવાસીઓ-મુલાકાતીઓ હવે ઇન્ડોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે આ દીપડાની જોડીને નિહાળી શકશે. વન્યજીવ સપ્તાહ-૨૦૨૩ નિમિત્તે 'ગીર' ફાઉન્ડેશન, દ્વારા ઇન્ડોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે 'વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી એક્ઝિબિશન'નું ગુજરાતના પીસીસીએફ એન્ડ હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ શ્રી એસ.કે.ચતુર્વેદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન તા. ૦૮ ઓક્ટોબર સુધી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ૨૦૦થી વધારે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી ઈકો કલબ ધરાવતી શાળાએ બનાવેલ વિવિધ વેસ્ટમાંથી બેસ્ટ ક્રુટિઓ અને વિવિધ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગુજરાતના પીસીસીએફ એન્ડ હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ શ્રી એસ.કે.ચતુર્વેદીએ જણાવ્યું હતું કે,



વન્ય જીવો આપણી ધરોહર છે જેથી તેને બચાવવા જોઈએ. તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરતા વન્યજીવ પારિસ્થિતિકીય તંત્ર માટે અને આપણા અસ્તિત્વ માટે ખૂબ જ મૂલ્યવાન છે તેમ, તેમણે ઉમેર્યું હતું. ગીર ફાઉન્ડેશનના નિયામક શ્રી આર. કે. સુગુરે આ પ્રસંગે સૌને વન્યજીવ સંરક્ષણની ઝુંબેશમાં સહભાગી થવા અને આ વર્ષની થીમ 'પાર્ટિસિપેશન ફોર વાઈલ્ડ કન્ઝર્વેશન'માં જોડાઈ જવા માટે આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગીર ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહ નિમિત્તે પ્રતિવર્ષ વન્યજીવ સંરક્ષણ અને લોકજાગૃતિ કેળવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહ નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં પાંચ કેટેગરીમાં ૨૦૦થી વધુ ફોટો મળ્યાં હતાં. જેમાંથી પસંદ કરાયેલા ફોટોગ્રાફીસ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત ગુજરાતના જાણીતા એવા ૩૦ જેટલા પ્રતિષ્ઠિત તરવૈરકારો દ્વારા લેવાયેલા દુર્લભ-સુંદર ફોટોગ્રાફીસ પણ આ પ્રદર્શનમાં સામેલ કરાયા છે. આ પ્રસંગે પીસીસીએફ- વાઈલ્ડ લાઈફ શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, એડીજી ઓફ પોલીસ શ્રી નરસિમ્હા કોમર, ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક શ્રી આર.પી.લેલોત, શ્રી આર.બી.સોલંકી તેમજ તારક મહેતા ફેમ ટ્યુ - શ્રી ભવ્ય ગાંધી સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.



# સેન્સેક્સમાં ૩૬૪ અને નિફ્ટીમાં ૧૦૮ પોઈન્ટનો વધારો જોવા મળ્યો

બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન કંપની, ઇન્ડસ્ટ્રીયલ બેંક અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા

મુંબઈ, તા.૬ | વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાને કારણે બજારમાં ખરીદીનો મૂડ જોવા મળી રહ્યો છે. આજે સમાહના અંતિમ દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. કારોબારી સમાહના અંતિમ દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, આઈટી અને ફાર્મા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મેટલ, પીએસઈ, બેંકિંગ ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૩૬૪.૦૬ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકાના વધારા સાથે ૬૫,૮૯૫.૬૩ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૦૮.૭૫ અંક એટલે કે ૦.૫૫ ટકાના



વધારા સાથે ૧૮૬૫૩.૫૦ ના સ્તર પર બંધ થયો હતો. બીએસઈનો ૫૦ શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૫૦ પોઈન્ટથી વધુના વધારા સાથે ૩૬૪.૦૬ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકાના

વધારા સાથે ૬૫,૮૯૫ ના સ્તર પર બંધ થયો. આ સિવાય એનએસઈનો નિફ્ટી ૧૦૫.૭૦ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકાના વધારા સાથે ૧૮,૬૫૧ પર બંધ થયો હતો. નિફ્ટીના ૧૨ સૂચકાંકોમાંથી, ૧૧ સેક્ટોરલ ઈન્ડેક્સ એવા છે જે વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. મીડિયા શેરો સિવાય અન્ય સેક્ટર સારા ઉછાળા સાથે બંધ થયા છે. રિયલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ ૩.૦૮ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. નાણાકીય સેવાઓ ૧.૦૪ ટકા અને ફાર્મા શેર ૦.૭૧ ટકા વધ્યા હતા. મેટલ શેરમાં કારોબાર ૦.૫૩ ટકાના વધારા સાથે બંધ થયો હતો. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન કંપની, ઈન્ડસ્ટ્રીયલ બેંક અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. જ્યારે એચયુએલ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ભારતી

એરટેલ અને એક્સિસ બેંક નિફ્ટીના ટોપ લૂઝર હતા. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૩ શેરો લીલા નિશાન સાથે અને માત્ર ૭ શેરો લાલ નિશાન સાથે બંધ થયા હતા. ટોપ ગેઇનર્સમાં, બજાજ ફિનસર્વ ૫.૮૬ ટકા ઉપર રહીને બજારને તેજી આપવામાં મહત્વની ભુમિકા ભજવી. બજાજ ફાઇનાન્સ ૪.૦૫ ટકા અને ટાઇટન ૨.૮૮ ટકાના વધારા સાથે વેપાર બંધ કર્યો હતો. ઈન્ડસ્ટ્રીયલ બેંક ૨.૩૮ ટકા અને આઈટીસી ૧.૪૨ ટકા ઉપર રહ્યા હતા. ડેએસબલ્યુ સ્ટીલ ૧.૨૬ ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે. એચયુએલ સેન્સેક્સમાં ૦.૮૩ ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યા. એશિયન પેઈન્ટ્સ ૦.૩૭ ટકા, એક્સિસ બેંક ૦.૨૬ ટકા, એલએન્ડટી ૦.૧૩ ટકા, એચડીએફસી બેંક ૦.૧૧ ટકા અને નેસ્લે ૦.૦૩ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

# સિક્કિમમાં આભ ફાટતાં ગંભીર સ્થિતિ સર્જઈ સિક્કિમમાં ૧૪૦૦૦ કરોડના ડેમ સંદર્ભે અનેક વખત ચેતવણી અપાઈ હતી

ફલડનું નિરીક્ષણ કરતી સિસ્ટમ અંગે રીડિંગ પર ધ્યાન ન અપાયું, જે સમયસર એલર્ટ કરાયા હોત તો કદાચ નુકસાનથી બચી શકાયા હોત

ગંગટોક, તા.૬ | તાજેતરમાં જ સિક્કિમમાં આભ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં લ્હોનાક લેકમાં એટલી હદે પાણી આવી ગયું કે ગ્લેશિયલ લેક આઉટબ્રેક્ટ ફલડની ઘટના બની અને તેના લીધે તીસ્તા નદી ગાંડીતૂર બની હતી. જેના પગલે અત્યાર સુધીમાં ૧૪ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને ૧૦૨થી વધુ લોકો ગુમ થઈ ગયા. ભયાનક પૂરમાં ૨૨ જેટલા આર્મીના જવાનોનો પણ કોઈ અતોપતો મળી રહ્યો નથી. આ માહિતી સેન્ટ્રલ વોટર કમીશન દ્વારા આપવામાં આવી હતી. જો તમે સિક્કિમના સૌથી મોટા ડેમ તીસ્તા ડેમ વિનાશના દંશ્યો પર નજર કરશો તો તમને જણાઈ આવશે કે આ સર્વનાશ પાછળ પૂરના નિરીક્ષણ માટેની સિસ્ટમની નિષ્ફળતા પણ જવાબદાર દેખાશે. ભયાનક પૂરના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ૬૦ ફૂટ ઊંચાઈ ધરાવતો આ તીસ્તા ડેમ ધોવાઈ જાય છે. આ ડેમની ૧૨૦૦ મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા હતી અને તે રાજ્યનો સૌથી મોટો ડેમ હતો. આ ડેમનું નિર્માણ ૨૦૦૮માં શરૂ થયું હતું અને ૨૦૧૭માં તેનું કામ પૂરું થયું. તેની પાછળ ૧૪૦૦૦ કરોડનો ખર્ચ કરાયો હતો. સિક્કિમમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ૪ ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ૪ ઓક્ટોબરના રોજ બપોરના ૧:૩૦ વાગ્યે સાનકલાંગ સ્ટેશન ખાતે પાણીનું સ્તર ૧૯ મીટર વધી ગયાની માહિતી આપવામાં આવી હતી. જોકે ૩ ઓક્ટોબરના રોજ સવારના ૧૦:૦૦ વાગ્યે સેન્ટ્રલ વોટર કમીશનની વેબસાઈટ પર કોઈ રીડિંગ જોવા મળ્યું નહોતું.



અહેવાલો અનુસાર તીસ્તા ડેમથી ૨૦ કિ.મી. ઉપર ફલડ મોનિટરિંગ કરવાનું કાર્યાલય આવેલું છે. જો ૩-૪ ઓક્ટોબરે યોગ્ય રીતે મોનિટરિંગ કરાયું હોત તો કદાચ આ વિનાશની સચોટ ભવિષ્યવાણી કરી શકાઈ હોત અને પૂરની તૈયારીઓ કરી શકાઈ હોત અને ડેમને તૂટતાં પણ બચાવી શકાયો હોત. બીજી બાજુ સીડબલ્યુસીની પૂર વિશે આગાહી કરતી વેબસાઈટ ઉપર પણ કોઈ માહિતી અપલોડ ન થઈ હતી. દિલ્હીમાં આવેલું એક એડવોકેસી ગ્રૂપ સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ, રિવર્સ એન્ડ પીપલ પાણીને લગતાં વિષયો પર પર કામ કરતું એક ઔપચારિક નેટવર્કનું સંગઠન છે. તે આ મામલે સ્વતંત્ર રીતે કામ કરે છે. તેણે સિક્કિમના પૂર વિશે ટ્વિટર પર વિગતવાર માહિતી શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે ગંગટોકની ઉત્તરે આશરે ૯૦ કિ.મી. દૂર યુગથાંગ આવેલું છે અને ત્યાં મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધનીય નુકસાન થયું હતું. સંરક્ષણ મંત્રાલયને જાણ કરાઈ હતી કે ઉત્તર સિક્કિમમાં બે ટ્રિજને નુકસાન થયું હતું. તીસ્તા નદીમાં આવેલા પૂરને લીધે નેશનલ હાઈવે નંબર-૧૦ પર વાહનોની અવર-જવર ઘપ થઈ ગઈ છે. સાઉથ લ્હોનાક લેક

અંગે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રુરકી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર દ્વારા ૨૦૨૧માં રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં ગ્લેશિયલ લેક આઉટબ્રેક્ટ ફલડની ઘટના બનશે તેવી આગાહી કરી દેવામાં આવી હતી. ખાસ કરીને રિસર્ચરોએ દક્ષિણ લ્હોનાક લેક પર ખતરનાને હાઈલાઈટ કર્યો હતો અને લેકના ફેલાવા અને તે ગમે ત્યારે તૂટી પડશે તેવી આગાહી કરતી વિગતો શેર કરી હતી. સિક્કિમમાં આવેલો સાઉથ લ્હોનાક લેક દરિયાની સપાટીથી લગભગ ૫૨૦૦ મીટર ઊંચાઈએ હોવાથી ખતરો વધારે જ હતો. તે એવા ૧૪ ખતરનાક સંભવિત તળાવોમાં સામેલ હતું જ્યાં ગ્લેશિયલ લેક આઉટબ્રેક્ટ ફલડની ઘટના બની શકે તેમ હતી. સિક્કિમમાં આવેલી ભયાનક આપત્તિએ ભારે કેર વર્તાવ્યો. ક્લાઈમેટ ચેન્જને લીધે ગ્લેશિયર પીગળવાનું સૌથી વધુ જોખમ રહે છે. દરમિયાન ૧૦ વર્ષ પહેલાં જ પ્રકાશિત ફેબ્રુઆરી ૨૦૧૩માં કરન્ટ સાયન્સ જર્નલમાં ઈસરોના બે વૈજ્ઞાનિકો અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના એક વૈજ્ઞાનિકનું રિસર્ચ પેપર સામે આવ્યું. તેમાં જ તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે સિક્કિમનું સાઉથ લ્હોનાક ગ્લેશિયર પાછળ બસી રહ્યું છે. તેના લીધે તેના ફાટવા અને તબાહી સર્જવાની સંભાવના વધુ છે. હવે સવાલ એ છે કે શું આ ચેતવણી બાદ એજન્સીઓએ જરૂરી પગલાં ભર્યાં હતા કે નહીં? ફેબ્રુઆરી ૨૦૧૩માં ડૉ.એસ.એન.રામ્યાએ કરન્ટ સાયન્સ જર્નલમાં છપાવેલા આ રિસર્ચ પેપરમાં સેટેલાઈટના ડેટાનો હવાલો આપી કહ્યું હતું કે સિક્કિમનું લ્હોનાક ગ્લેશિયર ૧૯૬૨ થી ૨૦૦૮ વચ્ચે ૧.૮ કિ.મી. પાછળ જતું રહ્યું છે.

# ઇસરોએ ગગનયાન માટે એસ્ટ્રોનૅટ્સ પણ પસંદ કર્યા

નવી દિલ્હી, તા.૬ | ચંદ્રયાનની સફળતા પછી ઈસરો હવે ગગનયાનની તૈયારી કરી રહ્યું છે. ઈસરોએ તે માટે 'એસ્ટ્રોનૅટ્સ' પણ ચૂંટી કાઢ્યા છે. જો કે સ્પેસ એજન્સીએ આ અંગે કશું કહ્યું નથી પરંતુ ભારતીય વાયુસેનાના એક વિડિયો ઉપરથી આ અંગેનો સંકેત મળી રહ્યો છે. આઈએએફ દ્વારા તેની ૯૧મી જયંતિએ માર્શકો બ્લોગિંગ પ્લેટફોર્મ 'એક્સ' ઉપર (પૂર્વના ટ્વિટર) ઉપર એક વિડિયો વહેતો મુક્યો છે. ૧૧ મિનિટ્સના આ વિડિયોમાં વાયુસેનાની સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે. મહત્વની વાત તે છે કે આ વિડિયોમાં વાયુસેનાના ૩ જવાનોની ઝલક પણ દર્શાવાઈ છે. કે જેમને 'ગગનયાન' માટે ચૂંટી કાઢ્યા છે. આ ત્રણે જવાનો તે માટે તૈયારીઓ કરતા દેખાય છે. જો કે, સુરક્ષાની દ્રષ્ટિએ એસ્ટ્રોનૅટ્સના નામ કે અન્ય કોઈ ઓળખાણ જાહેર કરાયા નથી. ઈસરોએ જણાવ્યું છે કે, બેંગ્લુરુ પાસેની એસ્ટ્રોનૅટ્સ ટ્રેનિંગ ફેસિલિટીમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એસ્ટ્રોનૅટ્સ માટેના મોડ્યુલમાં શૈક્ષણિક પાઠ્યક્રમ, ગગનયાન ઉડાણ પ્રણાલી, પેરાબોલિક ઉડાણોના માધ્યમથી સૂક્ષ્મ ગુરૂત્વાકર્ષણનો પરિચય, એરો મેડિકલ પ્રશિક્ષણ, વાપસી અને પુનર્વાસ પ્રશિક્ષણ (ટ્રેનિંગ), ઉડ્ડયન પ્રક્રિયાઓમાં આવડત મેળવવી, ચાલકદલ પ્રશિક્ષણ, તથા સિમ્યુલેટર પરની ટ્રેનિંગ સામેલ છે. તે ઉપરાંત હવાઈ ચિકિત્સા ટ્રેનિંગ, આવધિક ઉડ્ડયન અભ્યાસ અને યોગને પણ સામેલ કરવામાં આવેલ છે. સૌથી મહત્વની વાત તો તે છે કે ઈસરો આ મિશનમાં માનવ સુરક્ષા ઉપર ભાર મૂકે છે. સ્પેસ એજન્સી વધુમાં જણાવે છે કે, આ સાથે કેટલીયે આધુનિક ટેકનીક વિકસિત કરાઈ રહી છે. ગગનયાન મિશન ૨૦૨૪માં લોન્ચ થશે તેમ મનાય છે. તે સાથે માનવીને અંતરિક્ષ મોકલવાના ભારત ચોથો દેશ હશે. આ સૂચિમાં રશિયા અમેરિકા અને

ન્યૂઝ ફિક્સ

ગરબા આયોજકોએ ખેલેયાઓ માટે લેવી પડશે વીમા પોલિસી

અમદાવાદ, તા.૬ |

નવરાત્રિનું કાર્ટુનડાઉન શરૂ થતા જ ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાર્ડડલાઈન્સ જાહેર કરી હતી. આ ગાર્ડડલાઈન્સ અનુસાર, ગરબા આયોજકોએ હવે ખેલેયાઓ માટે વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ગરબા આયોજન સ્થળે ઝડૂક અને પાર્કિંગની માહિતી પોલીસને ફરજિયાત આપવી પડશે. અમદાવાદમાં ૫૦થી વધુ પાર્ટીપ્લોટ અને ક્લબોમાં ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે ગરબા આયોજકો માટે પોલીસે ૧૨ મુદ્દાની ગાર્ડડલાઈન્સ બહાર પાડી હતી. જેમાં પોલીસ પરમિશન લેવા માટે ફાયર સેફ્ટી, ગર્વમેન્ટ ઓથોરાઈટીઝ ઈલેક્ટ્રિશિયનનું પ્રમાણપત્ર, આર્ટિસ્ટનું સંમતિ પત્ર, મહિલા અને પુરુષ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો ફરજિયાત આપવી પડશે. સાથે જ આયોજનના સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે ૧૦૦ મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. નવરાત્રિ મહોત્સવ ૨૦૨૩ દરમિયાન સ્વાસ્થ્યને લગતી ખાસ દેવરશ્વા વડોદરામાં ઉભી કરાઈ છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટકની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે જેથી આ વખતે નવરાત્રિમાં ખાસ ડોક્ટરી વ્યવસ્થા રાખવામાં આવશે. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે ગરબા આયોજકો દ્વારા કરવામાં આવેલી ડોક્ટરી વ્યવસ્થાને લઈને ખુલાસો કર્યો છે, તેમણે કહ્યું હતું કે, આ વખતે વડોદરામાં ગરબા આયોજકો દ્વારા એમ્બ્યુલન્સ અને ડોક્ટર-નર્સના સ્ટાફને ગ્રાઉન્ડમાં જ ખડે પગે રખાશે. યોગેશ પટેલે કહ્યું કે, વડોદરાના તમામ મોટા ગરબા આયોજકોએ ગ્રાઉન્ડ ખાતે જ ડોક્ટર સાથેની ટીમોની વ્યવસ્થા ઉભી કરી છે. ગરબા ગ્રાઉન્ડ બહાર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ છે. વડોદરાના વી.એન.એક ગરબાના આયોજક મયંક પટેલે પણ આ ખાસ વ્યવસ્થા અંગે મોટું નિવેદન આપ્યું છે.




ભાજપ દ્વારા રાહુલ ગાંધીના કાર્ટૂનવાળા પોસ્ટરના વિરોધમાં પાલડી કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨’ ના સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધી રાજ્યમાં ૫,૭૫,૪૧૧ જેટલા જીવો બચાવાયા

અમદાવાદ, તા.૬ |

ગુજરાત સરકાર દ્વારા ચાલતી ‘કરુણા એનિમલ હેલ્થકાર્ડ ૧૯૬૨’ એ પોતાના ૬ વર્ષ પૂર્ણ કર્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ ૩૭ જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ હેલ્થકાર્ડનું રખડતા પશુ-પક્ષીઓ કે જેના કોઈ માલિક નથી, રોડ એક્સિડન્ટમાં કે કોઈ પ્રકારે ઈજા પામેલ હોય અથવા અન્ય કોઈ રીતે ઘાયલ થયેલ હોય તેવા અખોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવે છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં આશરે ૫,૭૫,૪૧૧ જેટલા જીવો બચાવ્યા છે. અમદાવાદ જિલ્લામાં આશરે ૨,૦૬૪ જેટલા જીવો આ સેવા દ્વારા બચાવાયા છે. દિવસેને દિવસે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્થકાર્ડને વિશે લોકો માહિતગાર થઈ રહ્યા છે.



ત્યારે આવનારા દિવસોમાં પણ એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો થઈ શકે છે તેવું ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર પ્રોજેક્ટ કો ઓર્ડિનેટરની અબબારી યાદીમાં જણાવાયું છે.

અંબાજીમાં ઘીમાં ભેળસેળ મામલે વધુ એક ખુલાસો ઘીમાં ભેળસેળનું સામે આવતા દુષ્યંત સોની ફરાર થઈ ગયો અમદાવાદથી દુષ્યંત સોની નામના પાસેથી ખરીદી હોવાનો પર્દાફાશ થયો છે, ત્યારબાદ ઘીમાં ભેળસેળનું સામે આવતા હાલ રાજ્યભરમાં આ મુદ્દો ગાજી રહ્યો છે

અંબાજી, તા.૬ |

અંબાજીમાં ઘીમાં ભેળસેળ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બાદ આ મામલે વધુ એક ચક્રવર્તી ખુલાસો થયો છે. જેમાં મુખ્ય આરોપી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી દુષ્યંત સોની નામના પાસેથી ખરીદી હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારબાદ ઘીમાં ભેળસેળનું સામે આવતા હાલ રાજ્યભરમાં આ મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે દુષ્યંત સોની ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે. પોલીસની આ તપાસમાં ભેળસેળના કેસમાં અન્ય વેપારીની પણ સંડોવણી ખુલે તો નવાઈ નહિ. સમગ્ર કેસની વાત કરીએ તો અંબાજી ખાતે

તારીખ ૨૩ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું. આ મહામેળામાં માનવ મેદની ઉમટી પડી હતી અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા તેમને પ્રસાદમાં મોહનથાળ પીરસાઈ છે જેના સ્ટોકને પહોંચી વળવા માટે એજન્સી દ્વારા ઘીનો જથ્થો અગાઉથી મંગાવી લેવામાં આવ્યો હતો. બાદમાં ઘીના સેમ્પલ ફેલ થતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે. અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવતા ઘીનો રેલો અંબાજીથી સીધો અમદાવાદ પહોંચ્યો હતો. હાલ નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહેની અટકાયત કરી લેવામાં આવી છે અને આ અંગે ઊંડાણ પૂર્વકની તપાસ ચાલી રહી છે.

સુરતમાં ફરી લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં ગરોળી ચાવી ગયા બાદ હવે અઠી વર્ષના બાળક પર ગરમ દાળ પડી

ઘટનાની ૧૫૫ થતાં ૧ માતા દોડી આવી હતી અને બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો

સુરત, તા.૬ |

હાલના સમયમાં માતા પિતા પોતાના કામમાં વ્યસ્ત હોય તેવામાં બાળકો કંઈક એવું કરી બેસતા હોયા છે કે જેનો પસ્તાવો આખી જિંદગી પરિવારને થતો હોય છે. ગઈકાલે (ગુરવાર) સુરતમાં એક ૭ મહિનાનું બાળક ગરોળી ચાવી ગયું હતું, ત્યારબાદ આજે એક એવી ઘટના બની છે કે સમગ્ર ગુજરાતના વાલીઓ માટે લાલબત્તી સમાન ગણી શકાય એમ છે. સુરતમાં ફરી વાલીઓ માટે આજે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં રમતા રમતા અઠી વર્ષના બાળક પર ગરમ દાળ પડી છે. જી હા... લાજપોર ગામ ખાતે ઘરમાં બાળક રમતો હતો, ત્યારે માતા ઘરમાં ચૂલા પર દાળ બનાવતા અન્ય કામમાં લાગી ગઈ હતી. તેવામાં દુર્ભાગ્યવશ બાળક રમતા રમતા ચૂલા પાસે પહોંચી ગયો હતો. બાળક કંઈ સમજે નહીં તેવી સ્થિતિમાં હાથમાં રહેલ લાકડી દાળના તપેલાને મારી હતી. જેના કારણે તપેલો પલટી મારતા બાળક ગંભીર રીતે દાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ માતા દોડી આવી હતી અને બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો તમારા ઘરમાં નાના બાળકો છે તો આ સમાચાર તમારા માટે છે. સુરતમાં

માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં કડોદરા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં સાત મહિનાની બાળકી ગરોળી ચાઈ ગઈ છે. એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અભિષેકસિંહની ૭ મહિનાની દીકરી નિતારા ઘરમાં એકલી રમી રહી હતી તે દરમિયાન તેમની બાજુ માંથી એક ગરોળી પસાર થતી હતી. બાળકી એ રમત રમતમાં આ ગરોળીને પકડી લીધી હતી અને સીધી જ પોતાના મોમાં મૂકી ગરોળીને ચાવી લીધી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાયેલી હતી. બાળકીની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી. બાળકીને માતાએ ગરોળી ચાવાવતા જોતા દોડી આવી હતી. બાળકીના મોઢામાંથી ગરોળી કાઢી ફેંકી દીધી હતી. બાળકીને તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત હોવાથી સમગ્ર વાતથી અજાણ હતી. પરંતુ બાળકીના હાથમાં ચાવેલી ગરોળી જોતા માતાના હૌસ ઉડી ગયા હતા. બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાને લઈ ગઈ હતી. જો કે ગરોળી જેવી ચીજ ચાવી જતા તાત્કાલિક જ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પરિવારે ચલાવ્યું એવું જુદાંજુદું કે પોલીસ ગોથે યટી સુરતમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત

સુરત, તા.૬ |

ઉંધનામાં વિદ્યાર્થીની બેભાન મોત મામલે વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. વિદ્યાર્થીના પરિવારે આપઘાતનું કારણ છુપાવ્યું હતું. વિદ્યાર્થીની વાસણ સફાઈ કરતા અચાનક ઢળી પડી ગઈ હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસને શંકા જતા ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના ઉંધના વિસ્તારમાં આવેલ ગાંધીકુટીર ખાતે રહેતા સુનિલ પાટીલની ૧૪ વર્ષની દીકરી પાયલ પાટીલ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. ગત રોજ બપોરના સમયે પરિવારના લોકો પાયલને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડાહજર તબીબોએ

પાયલને મૃતક જાહેર કર્યો હતો. ફોરેન્સિક પીએમમાં મૃતક પાયલ પાટીલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે ગત રોજ ૧૫ વર્ષની એક દીકરીને ઉંધનામાંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં સારવાર અર્થે લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડાહજર તબીબોએ દીકરીને મૃતક જાહેર કર્યો હતો. પરિવારે દીકરી ઘરમાં કામ કરતા કરતા બેભાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. દીકરીના ગળા પર નિશાન દેખાય આવતા શંકા ગઈ હતી. ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. ફોરેન્સિક પીએમમાં દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે.

૧૦૦ માર્ફકોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ કબ્જે કરાઈ પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પાલિકાના દરોડા

આણંદ નગર પાલિકાએ વેપારીઓ આ કાયદાઓ કડક પાલન કરે તે માટે ટિમ બનાવી ચેકીંગ શરૂ કરાવ્યું છે

આણંદ, તા.૬ |

સરકાર દ્વારા ૧૦૦ માર્ફકોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિયમન પાલન માટે પણ જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નગર પાલિકાએ વેપારીઓ આ કાયદાઓ કડક પાલન કરે તે માટે ટિમ બનાવી ચેકીંગ શરૂ કરાવ્યું છે. સરકાર દ્વારા ૧૦૦ માર્ફકોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિયમન પાલન માટે પણ જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદનગર પાલિકાએ વેપારીઓ આ કાયદાઓ કડક પાલન કરે તે માટે ટિમ બનાવી ચેકીંગ શરૂ કરાવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરી જથ્થો સીઝ કરવામાં

આવી રહ્યો છે. આણંદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અધિકારીના માર્ગદર્શન હેઠળ આણંદ નગરપાલિકાની વિવિધ ટીમની રચના કરવામાં આવી છે. આણંદના સરદાર ગંજ ખાતેના પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે આકસ્મિક ચકાસણી કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. બજારમાં જે વેપારીઓ ૧૦૦ માર્ફકોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક બેગનું વેચાણ કરતા હતા તેવા તનિષા પ્લાસ્ટિક, ધનલક્ષ્મી પ્લાસ્ટિક અને સાઈ એન્ટરપ્રાઇઝ ખાતેથી તપાસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપાયો હતો.

ગિફ્ટી સીટીમાં ૩૦૦ બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે

અમદાવાદ, તા.૬ |

કિશોર મહેતાના પરિવારે પ્રતિષ્ઠિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટી, ગાંધીનગર ખાતેની પોતાની ૩૦૦ બેડની, મલ્ટિ-સ્પેશિયાલિટી ચેરિટેબલ હોસ્પિટલના નિર્માણ કાર્યમાં નવા જોશ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ હોસ્પિટલ અત્યાધુનિક તબીબી સાધનો, વિશ્વકક્ષાની આરોગ્ય-સંભાળની સુવિધા અને વિખ્યાત તબીબોથી સજ્જ હશે, જે સમગ્ર વિસ્તારના દર્દીઓને સેવા પૂરી પાડશે. હોસ્પિટલ આ ક્ષેત્રમાં જરૂરી ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ ઉપલબ્ધ બનાવશે. આ પ્રોજેક્ટના

માનદ સલાહકાર તરીકે કિશોર મહેતા અને રાજેશ મહેતાના સમાવેશ સાથે વિલાવતી ફાઉન્ડેશન નામના ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને માત્ર હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ અને કંપનીઓ પાસેથી મળતા સખાવતી દાન દ્વારા જ ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. બંને મહાનુભાવોએ પ્રકારની હોસ્પિટલો સ્થાપવામાં રહેલી તેમની કુશળતાને લાભ ઉપલબ્ધ બનાવશે. તેઓ લીલાવતી કિર્તીલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (એલકેએમએમટી)ના ટ્રસ્ટી છે, જેણે મુંબઈની પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.

૯૩૪૦ કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું સરકારી અનાજના ગોડાઉનમાં ચણાનો જથ્થો લેબમાં ફેલ થયો પાદરના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી

વડોદરા, તા.૬ |

સરકારી અનાજના ચણાનો જથ્થો એફ.આર. એલમાં ફેઈલ થતા પાદરા ગોડાઉનમાં ફાળવેલ ૯૩૪૦ કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પાદરા ફરી એકવાર સરકારે ફાળવેલા ચણામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના પાદરાના ગોડાઉનમાં સરકારે ફાળવેલા ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થયો છે. જિલ્લા પુરવઠા વિભાગને મળેલા ૯,૩૪૦ કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો કર્યો છે. લેબોરેટરી ટેસ્ટિંગ વગર જ ચણાનો જથ્થો ફાળવ્યો હોવાની આશંકા સેવવામાં આવી છે. સરકારી અનાજના ચણાનો જથ્થો એફ.આર.એલમાં ફેઈલ થતા પાદરા ગોડાઉનમાં ફાળવેલ ૯૩૪૦ કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. સરકારી ચણાનો જથ્થાનો કોસ વેરિફિકેશન

કરવામાં આવતા ચણાનો જથ્થો ખરાબ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પાદરાના સરકારી ગોડાઉનમાં ફાળવેલ ચણાનો તમામ જથ્થો ૯૩૪૦ કિ. ગ્રામ. એફ.આર.એલમાં ફેઈલ થઈને ખરાબ નીકળતા તેનું વિતરણ અટકાવ્યું હતું. પાદરાના ગોડાઉન માં ૯૩૪૦ કી. ગ્રામ જ જથ્થો વર્ધનામ એગ્રો ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સલામત કરવામાં આવ્યો હતો ત્યાં ઉપલબ્ધ ચણા ના જથ્થા નું કોસ વેરિફિકેશન કરાવવા માટે ગાંધીનગર ની ફૂડ રિસચ લેબોરેટરી માં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેનું ટેસ્ટિંગ કરાવ્યું હતું જેનો રિપોર્ટ ફેઈલ આવ્યો હતો સૂત્રો ના જણાવ્યા અનુસાર આ જથ્થો આઈ.સી.ડી.એસનો ફળવવાનો હતો. પરંતુ ફાળવેલ જથ્થો લેબમાં ફેઈલ થતા હાલમાં પાદરા સરકારી અનાજના ગોડાઉનમાં વિતરણ અટકાવ્યું છે. આ અંગેની ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષા એ જાણ કરી છે અને હવે પછી આ તમામ જથ્થો સલામત દ્વારા પરત લેવામાં આવશે અને નવો જથ્થો આવ્યા બાદ આ પ્રક્રિયા હાથ ધરી અને સેમ્પલ પાસ થાય બાદ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત દૈનિક સમાચાર પત્ર ટિપ્પણિયો 9800708900 આ નંબર પર માત્ર વોટ્સએપ મેસેજ જ કરવો અપની આસપાસ બનતી ઘટનાઓના ફોટાઓ વીડીઓ મોકલી આપો દરેક જાતના પ્રસંગ, ઉમંગ, શાળાઓ, કોલેજોથી લઈને સોસાયટીઓ સુધી અવસરથી લઈને તહેવારો સુધી બધા જ સમાચારોને આવરી લેતુ અખબાર “ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત” દૈનિક હંમેશા તૈયાર રહે છે, આપની આસપાસ બનતી રસપ્રદ ઘટનાઓની માહિતી વોટ્સએપ નંબર ઉપર અથવા ઈ-મેઈલ પર અમને લખીને મોકલો... cnngujarat@gmail.com